

(જન્મ : 02-10-1869; અવસાન : 30-01-1948)

આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી - મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. રાજકોટ તેમજ ભાવનગરમાં અભ્યાસ કર્યા પછી ઈંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી મેળવી હતી. વકીલાતના વ્યવસાય માટે આફિક્ઝ ગયા. ત્યાં ભારતીયોના હક્કોના રક્ષણ માટે સત્યાગ્રહનો આરંભ કર્યો. આફિક્ઝથી ભારત આવ્યા. ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનોનું નેતૃત્વ લીધું. અસ્પૃશ્યતા નિવારણ તેમજ ખાઈ અંગે રચનાત્મક કાર્યો કર્યો. ‘હરિજન’, ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ પત્ર-સામયિકોનું લેખન-સંપાદન કર્યું. એમનું જીવન જ પ્રજાજીવનનો સંદેશ, દસ્તાવેજ બની રહ્યું.

‘હિંદ સ્વરાજ’, ‘ખરી કેળવણી’, ‘કેળવણીનો કોયડો’, ‘નીતિનાશને માર્ગો’, ‘ત્યાગમૂર્તિ’ અને બીજા લેખો તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે. તેમની ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’નો વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનાં સધળાં લખાણો ‘ગાંધીજીનો અક્ષરદેહ’ નામની ગ્રંથશ્રેષ્ઠીમાં સંગ્રહાયાં છે.

આપણું મન હંમેશાં સારું - સુષ્ણુ, નાજુક - નમણું જોવા સ્વીકારવા જ તૈયાર હોય છે. કિન્તુ તેથી ઉલટું ચિત્ર-વિચિત્ર, બેડોળ-કદરૂપું સ્વીકારવા જરાયે તૈયાર નથી જ નથી. નારાયણ હેમચંદ્ર રંગે - રૂપે - સ્વભાવે - અવાજે - પોશાકે, પૂરા માપે - ભારોભાર વિચિત્ર હતા છતાં તેમની અપાર પ્રવાસ પ્રીતિ - ભાષાજિજ્ઞાસા, નિખાલસતા - નિરભિમાનિતા, અખૂટ ધીરજ અને આત્મવિશ્યાસ જેવા ગુણોએ ગાંધીને મોહિત કર્યો. મનુષ્યના બાબુ વ્યક્તિત્વ કરતાં તેનાં આંતરિક સૌંદર્યને પરખવાની - પામવાની ગાંધીની આત્મસૂજ આપણને આકર્ષે છે. “મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા. તેઓ તો તેના હૃદયને તપાસે છે.” કાર્ડિનલ મેનિંગ વિષેની નારાયણ હેમચંદ્રની આ માર્મિક ટકોર આપણા બંધ આંતરદ્વારને ખોલવાની - સમજવાની ગુરુચાવી આત્મકથા ખડ-1નો આ ગદ્યબંદ આપણને સમજાવી જાય છે - જેનો આનંદ - ઓચ્છવ કરીએ તેટલો ઓછો ખરુને !

આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નેશનલ ઇન્ડિયન એસોસિયેશનવાળાં મિસ મેનિંગને ત્યાં મળ્યો. મિસ મેનિંગ જાણતાં હતાં કે મને બધાંની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગો મોઢે બેઠો રહેતો, કોઈ બોલાવે તો જ બોલું.

તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી.

નારાયણ હેમચંદ્રને અંગ્રેજ નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઈ ગયેલો, કંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઈ કોલર ન હતાં. કોટ પારસી ઘાટનો પણ ડેળ વિનાનો. માથે ફૂમતાવાળી ઊનની ગુંધેલી હોપી હતી. તેમણે લાંબી દાઢી રાખી હતી.

કદ એકવિદ્યું, ટીંગણું કહીએ તો ચાલે. મોં ઉપર શીળીના ડાઘ હતા. ચહેરો ગોળ, નાક નહિ અણીદાર, નહિ ચીબું. દાઢી ઉપર હાથ ફર્યો કરે.

બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.

“આપનું નામ મેં બહુ સાંભળ્યું છે. આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો ?”

નારાયણ હેમચંદ્રનો સાદ ભાંભરો હતો. તેમણે હસમુખે ચહેરે જવાબ આપ્યો :

“તમે ક્યાં રહો છો ?”

“સ્ટોર સ્ટ્રીટમાં.”

“ત્યારે તો આપણે પડોશી છીએ. મારે અંગ્રેજ શીખવું છે. તમે મને શીખવશો ?”

મેં જવાબ આપ્યો, “જો આપને કંઈ મદદ કરી શકું તો રાજ થાઉં. મારાથી બનતી મહેનત જરૂર કરીશ. આપ કહો તો હું આપને ત્યાં આવીશ.”

“ના, ના, હું જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠમાળા છે તે હું લેતો આવીશ.”

અમે વખત મુકરર કર્યો. અમારી વચ્ચે ભારે સ્નેહગાંઠ બંધાઈ.

નારાયણ હેમચંદ્રને વ્યાકરણ મુદ્દલ નહોતું આવડતું. ‘ઘોડો’ કિયાપદ બને ને ‘દોડવું’ નામ બને. આવા વિનોદી દાખલા તો મને કેટલાયે યાદ છે. પણ નારાયણ હેમચંદ્ર મને પી જાય તેવા હતા. મારા અલ્ય વ્યાકરણથી એ કાંઈ મોહી જાય તેવા ન હતા. તેમને વ્યાકરણ ન આવડે તેની શરમ તો હતી જ નહિ.

“હું કંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી. મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ. જુઓ, તમને બંગાળી આવડે છે ? મને તો બંગાળી આવડે. હું બંગાળમાં ફર્યો છું. મહર્ષિ દેવેન્દ્રનાથ રાગોરનાં પુસ્તકોનો તરજુભો તો ગુજરાતી પ્રજાને મેં જ આખ્યો છે ના ? મારે તો ધણી ભાષામાંથી ગુજરાતી પ્રજાને તરજુમા આપવા છે. તે કરવામાંયે હું શબ્દાર્થને નથી વળગતો. ભાવાર્થ આપું એટલે મને સંતોષ. મારી પછી બીજાઓ ભલે વધારે આપે. હું તો વગર વ્યાકરણે મરાઠી જાણું, હિન્દી જાણું, ને હવે અંગ્રેજ જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દભંડાર જોઈએ. તમે એમ ન જાણતા કે એકલા અંગ્રેજથી મને સંતોષ થવાનો છે. મારે તો ફાન્સ જવું છે, ને ફેન્સ પણ શીખી લેવું છે. હું જાણું છું કે ફેન્સ સાહિત્ય બહોળું છે. બનશે તો જર્મની પણ જઈશ ને જર્મન ભાષા શીખી લઈશ.”

આમ નારાયણ હેમચંદ્રની ધારા ચાલતી જ રહી. ભાષાઓ જાણવાનો અને મુસાફરી કરવાનો તેમનો લોભ અપાર હતો.

“ત્યારે તો તમે અમેરિકા જવાના જ.”

“જરૂર. એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે ?”

“પણ તમારી પાસે એટલા બધા પૈસા કર્યાં છે ?”

“મારે પૈસાનું શું કામ ? મારે કર્યાં તમારા જેવી ટાપટીપ કરવી છે ? મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું ? મારાં પુસ્તકોમાંથી કંઈક મળે છે તે અને થોડું મિત્રો આપે તે બસ થઈ જાય. હું તો બધે ત્રીજા વર્ગમાં જ જનારો રહ્યો. અમેરિકા ડેકમાં જઈશ.”

નારાયણ હેમચંદ્રની સાદાઈ તો તેમની પોતાની જ હતી. તેમની નિખાલસતા પણ તેટલી જ હતી. અભિમાનનું નામ નહોતું. પોતાની લેખક તરીકેની શક્તિ વિષે જોઈએ તેના કરતાં પણ વધારે વિશ્વાસ હતો.

અમે રોજ મળતા. અમારી વચ્ચે વિચાર તેમજ આચારસાભ્ય ઠીક હતું. બસે અન્નાહાર કરનારા હતા. બપોરના ધણી વેળા સાથે જમીએ. આ મારો અઠવાડિયાના સત્તર શિલિંગમાં રહેવાનો ને સ્વયંપાક કરવાનો કાગળ હતો. હું કોઈ વેળા તેમની કોટીએ જાઉં, તે કોઈ વેળા મારી કોટીએ આવે. હું અંગ્રેજ ફબની રસોઈ કરું, તેમને દેશી ફબ વિના સંતોષ ન જ વળે. દાળ જોઈએ જ. હું ગાજર ઈત્યાદિનો ‘સૂપ’ બનાવું તેથી મારી દયા ખાય. તેમણે મગ કયાંકથી શોધી કાઢ્યા હતા. એક દિવસ મારે સારુ મગ રાંધીને લાવ્યા ને મેં અત્યંત સ્વાદથી ખાધા. પછી તો અમારે આવી આપલે કરવાનો વહેવાર વધ્યો. હું મારી વાનગી તેમને ચખાડું ને તે મને પોતાની ચખાડે.

આ સમયે કાર્ડિનલ મેનિંગનું નામ સહુને મુખે હતું. ગોટીના મજૂરોની હડતાલ હતી. જોન બન્સ અને કાર્ડિનલ મેનિંગના પ્રયતનથી હડતાળ વહેલી બંધ થઈ. કાર્ડિનલ મેનિંગની સાદાઈ વિષે ડિઝરાયલીએ લખ્યું હતું તે મેં નારાયણ હેમચંદ્રને વાંચ્યું.

“ત્યારે મારે તો એ સાધુપુરુષને મળવું જોઈએ.”

“એ તો બહુ મોટા માણસ રહ્યા. તમને કેમ મળશો ?”

“હું બતાવું તેમ. તમારે મારે નામે કાગળ લખવો. હું લેખક છું એવી ઓળખાણ આપજો. તેમના પરોપકારી કાર્યનો ધન્યવાદ જાતે આપવા મારે મળવું છે એમ લખજો. ને એમ લખજો કે મને અંગ્રેજ વાત કરતાં ન આવડે તેથી મારે તમને દુભાષિયા તરીકે લઈ જવા પડશે.”

મેં એવા પ્રકારનો કાગળ લખ્યો. કાર્ડિનલ મેનિંગનો જવાબ બે ત્રણ દહાડામાં એક પત્તામાં આવ્યો. તેમણે મળવાનો સમય આખ્યો.

અમે બસે ગયા. મેં દસ્તૂર મુજબ મુલાકાતી કપડાં પહેર્યાં. નારાયણ હેમચંદ્ર તો જેવા હતા તેવા જ ! એ જ કોટ ને એ જ પાટલૂન ! મેં વિનોદ કર્યો. તેમણે મને હસ્તી કાઢ્યો ને બોલ્યા :

“તમે સુધરેલા બધા બીકણ છો. મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા, તેઓ તો તેમના હૃદયને તપાસે છે.”

અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યો. મકાન મહેલ જ હતું. અમે બેઠા કે તરત એક સુકલકડી, બુઢ્હા, ઉંચા પુરુષે પ્રવેશ કર્યો. અમારી બસેની સાથે હાથ મેળવ્યા. નારાયણ હેમચંદ્રને આવકાર દીધો.

“મારે આપનો વખત નથી લેવો. મેં તો આપને વિષે સાંભળ્યું હતું. આપે હડતાળમાં જે કામ કર્યું તેને સારુ આપનો ઉપકાર માનવો હતો. દુનિયાના સાધુપુરુષોનાં દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. તેથી આપને મેં આટલી તરદ્દી આપી.” આ વાક્યોનો તરજુમો કરી દેવાનું મને નારાયણ હેમચંદ્રે ફરમાવ્યું.

“તમે આવ્યા તેથી હું રાજ થયો. ઉમેદ રાખ્યું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે, ને અહીંના લોકોની તમે ઓળખાશ કરશો. ઈશ્વર તમારું ભલું કરો.” આમ કાર્ડિનલ બોલ્યા ને ઊભા થયા.

એક વેળા નારાયણ હેમચંદ્ર મારે ત્યાં ધોતિયું ને પહેરણ પહેરીને આવ્યા. ભલી ઘરધણિયાણીએ બારણાં ઉધાડ્યાં ને બીની. મારી પાસે આવી (આરાં ઘર તો હું બદલ્યા જ કરતો એ વાંચનારે યાદ હશે), ને બોલ્યી : “કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે.” હું દરવાજે ગયો ને નારાયણ હેમચંદ્રને જોયા. હું આબો જ બની ગયો. તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે.

“પણ તમને છોકરાંઓએ કનંગત ન કરી ?”

“મારી પાછળ દોડતાં હતાં. મેં કંઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયાં.” મને જવાબ મળ્યો.

નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારીસ ગયા. ત્યાં ફેન્ચ અભ્યાસ આદર્યો, ને ફેન્ચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. તેમનો તરજુમો તપાસવા પૂર્તાં ફેન્ચ મને આવડતું હતું. તેથી તે જોઈ જવા કચ્છું. મેં જોયું કે તે તરજુમો ન હતો પણ કેવળ ભાવાર્થ હતો.

છેવટે તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. મુસીબતે ડેકની કે ગીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારુ ‘અસત્ય પોશાક પહેર્યા’ ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.

“સત્યના પ્રયોગો”

શબ્દસમજૂતી

વિલાયત વિદેશ, પરદેશ ફૂમતું ગુચ્છ શીળી ઓચિંતા દીમણા થઈ આવતો એક રોગ ફૂલ ફટાક નાજુક, તકલાદી અહીં - વ્યવસ્થિત તરજુમો ભાષાંતર ટાપ્ટીપ સુધરતા, મરામત, બપકો શિલિંગ એક અંગ્રેજ સિક્કો, બાર આના જેટલો કોટડી ઓરડી ઢબ રીત, પદ્ધતિ ગોઢી અંદર પાણી કઢાય ઘલાય એવી સગવડવાળું વહાણો બાંધવાનું અને ઊભા રાખવાનું બંદર, ગોડાઉન, વખાર, ગાજર બુઢ્હા વૃદ્ધ દુભાષિયો બે ભાષા જાળનાર, એક ભાષાનો મતલબ (અર્થ) બીજી ભાષામાં કહેનાર, સમજાવનાર દસ્તૂર રિવાજ ધારો પારસી જતિના ગોર પાટલૂન યુરોપી ઘાટનો ચોરણો તરદી શ્રમ, મહેનત, તકલીફ પારીસ હાલનું પેરીસ નગર

રૂઢિપ્રયોગ

પી જવું ન ગાંધવું, સહન કરી જવું; મોહી જવું આસક્ત થવું

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો.

- (1) નારાયણ હેમચંદ્ર કર્યી કર્યી ભાષાના જાળકાર હતા ?
- (2) નારાયણ હેમચંદ્રને શો શોખ હતો ?
- (3) ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામ્ય જોવા મળે છે ?
- (4) અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શો આરોપ મુકાયો ?
- (5) શા કારણે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા ?



2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો.
- (1) નારાયણ હેમચંદ્ર કેવો પોશાક પહેરતા ?
 - (2) મહાપુરુષો વિશે હેમચંદ્રની શી માન્યતા હતી ?
 - (3) કાર્ડિનલ મેન્ઝિંગ સાથે નારાયણ હેમચંદ્રને શો અનુભવ થયો ?

3. સવિસ્તર ઉત્તર લખો.

- (1) નારાયણ હેમચંદ્રનું ચરિત્ર ચિત્રણ કરો.
- (2) નોંધ લખો.
 1. નારાયણ હેમચંદ્રની ખાસિયતો
 2. નારાયણ હેમચંદ્રની નિખાલસતા અને સાદાઈ

વિદ્યાર્થી પ્રવૃત્તિ

1. સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવોની યાદી બનાવી તેના વિશે ટૂંકી માહિતી એકત્ર કરી ભીતપત્ર પર મૂકો.
2. ‘સત્યના પ્રયોગો’ આત્મકથા મેળવીને વાંચો.

ભાષા-અભિવ્યક્તિ

નીચેનાં વિધાનો વાંચો.

* ‘કદ એકવારિયું, ઠીંગણું કહીએ તો ચાલે. મોં પર શીળીના ડાઘ હતા. ચહેરો ગોળ, નાક નહિ અણીદાર, નહિ ચીબું. દાઢી ઉપર હાથ ફર્યા કરે.’

અહીં નારાયણ હેમચંદ્રના દેખાવ વિશે બે વિશેષણો વપરાયાં છે. તમારા મનમાં આગળના ફકરામાં આપેલ તેના બાબુ પહેરવેશનું વર્ણન છે. તેના આધારે તમે તેનાં કદ-કાઢી વિશે અનુમાન કરી શકશો. આ અનુમાન કરવામાં - તમને પે'લાં બે વિશેષણો એકવારિયું અને ઠીંગણું બને કદ અને આકારનો અંદાજ લગાવવામાં ઉપયોગી થશે. પણ તમે વિચારો અહીં તેમના માટે તે ઠીંગણા કદના હતા તેવું નથી કહ્યું પણ ‘ઠીંગણા કહીએ તો ચાલે’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. આ બનેમાં શો તફાવત છે તે તમે વિચારો.

‘પણ નારાયણ હેમચંદ્ર મને પી જાય તેવા હતા. મારા અલ્ય બ્યાકરણાથી એ કાંઈ મોહી જાય તેવા ન હતા.’

તમે જોઈ શકશો ખરેખર તો શિખવાડનાર ગાંધીજી છે અને શીખનાર હેમચંદ્ર છે તેમ છતાં હેમચંદ્રની જ્ઞાનની અને શીખવાની બાબતમાં કેવી પ્રૌઢતા છે તે ગાંધીજીના વિધાનમાંથી નીતરે છે.

“તમે સુધરેલા બધા બીકણ છો. મહાપુરુષો કોઈના પોષાક સામું નથી જોતા. તેઓ તો તેના હદ્યને તપાસે છે.”

ઉપર્યુક્ત વિધાનોમાં ગાંધીજી અને તેના જેવા બીજા બાબુ ટાપટીપને મહત્વ આપનાર માણસોને તેમના બાબુ દંબ વિશે મોઢે કહી દેવાનું નિર્ભક વલણ તો છે જ - બીજા વિધાનમાં મહાપુરુષોની પણ કસોટી છે જ, જો આવા માણસો (મહાપુરુષો) માણસના બાબુ પરિધાન પરથી તેનું મૂલ્યાંકન કરે તો તેઓ આપોઆપ મહાપુરુષ મરી જાય !

શિક્ષક પ્રવૃત્તિ

રિચર્ડ એટનબરો દિગ્દર્શિત ‘ગાંધી’ ફિલ્મ અથવા ‘લગે રહો મુનાભાઈ’ ફિલ્મ બાળકો જોઈ શકે તે માટે શાળા કક્ષાએ અથવા અંગત રીતે વિદ્યાર્થી જોઈ શકે તેવી ગોઠવણ કરાવવી.

